

જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૦૮/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૪૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૫ કેસ કરી, ૪૬ વ્યક્તિઓને ઝડપી, ૧૭૮ લીટર દેશી દારૂ, ૧૫૦૮ બોટલ ઇંગ્લીશ દારૂ, ૯૬ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૪૦ બિયર ટીન, ૨ મોટર સાયકલ, ૨ સ્કૂટર અને ૧ ટવેરા કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭૨,૩૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૪૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૫૫૦/૧૮

વસ્ત્રાપુર: નિરવભાઈ જીતેન્દ્રભાઈ ચૌધરી (ઉ.વ.૨૮) (રહે. શકમ્બા ટાવર સ્ટર્લીંગ હોસ્પિટલની સામે ગુરુકુળ) એ તા.૧૧/૮/૧૮ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૯/૮/૧૮ સાજના ૬/૫૦ થી ૭/૩૦ વાગ્યા દરમિયાન બોડકદેવ સિંધુભવન રોડ પર બજારંગ સ્ટોર્સની સામે આવેલ કે-૧૫૮ માં ૬ નંબરની દુકાનમાં મેગસન ફેસ એડ ફોઝન દુકાન ખાતે મનીશભાઈ નામના વ્યક્તિએ નિરવભાઈને ફોન કરી જણાવેલ કે તમારી દુકાનની ઉપર વાળા મનીશભાઈ વાત કરૂ છુ તેમ કહી પૈસાની જરૂર હોઈ હર્ષ નામના માણસને મોકલુ છુ તેને ૬,૦૦૦/- રૂપિયા આપશો તેમ કહેતા થોડીવારમાં માણસ આવતા નિરવભાઈએ રૂપિયા ૬૦૦૦/- આપ્યા હતા. ત્યારબાદ ફરીથી ફોન કરી રૂપિયા ૧૦,૦૦૦/- માંગણી કરતા નિરવભાઈએ રૂપિયા ૧૦,૦૦૦/- આપ્યા હતા. ત્યારબાદ નિરવભાઈએ તેમની દુકાનની ઉપર રહેતા મનીશભાઈને પુછતા મનીશભાઈએ પૈસા બાબતે ફોન કરેલ નથી તેવુ જણાવેલ ત્યારે નિરવભાઈને ખબર પડી કે અજાણી વ્યક્તિ મોબાઈલ નંબર ૮૦૦૦૩૫૯૩૫૯ ના ધારકે છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.ડી.મકવાણા ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૫૫૧/૧૮

આનંદનગર: દેવલભાઈ રોહિતભાઈ શાહ (રહે. લાવણા સોસાયટી વાસણા) એ તા.૧૧/૮/૧૮ નારોજ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૯/૮/૧૮ રાતના ૮/૩૦ થી તા.૧૦/૮/૧૮ કલાક ૧૦/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન શ્યામલ રો હાઉસ ૩/ બી શ્યામલ ચાર રસ્તા પાસે કાફ્ટીસંસ નામની દુકાનના તાળા તોડી અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી સાડી નંગ-૪ કિમત રૂપિયા ૭૪,૫૦૦/- અને ડી.વી.આર. કિમત રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૮૪,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.કે.બારડ ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૫૫૨/૧૮

શહેરકોટડા: ભરતભાઈ ડાહ્યાભાઈ વાઘેલા (ઉ.વ.૩૮) (રહે.બાપાલાલ છગનલાલ કડિયાની ચાલી પોટલીયા ચાર રસ્તા પાસે સરસપુર) તા.૧૦/૮/૧૮ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પ્રાયમસ ઉપર ચા બનાવતા હતા ત્યારે પ્રાયમસમાં ભડકો થતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતુ. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દીલીપકુમાર વસંતલાલ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૫૫૩/૧૮

રીવરફ્રંટ ઇસ્ટ: મહેશ ઉર્ફે ઘોઘા અમરસિંહ લોરીયા (ઉ.વ.૨૦) (રહે. સૌરાસ્ટ્ર શ્રમજીવીનગરના છાપરાં શાલીભદ્ર ટાવરની પાછળ જુના વાડજ) એ અગમ્ય કારણસર તા.૧૧/૮/૧૮ બપોરના ૪/૦૦ વાગ્યા પહેલા રીવરફ્રંટ વોક વે નજીક નદીમાં પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રંટ ઇસ્ટ પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ હે.કો.શ્રી મહેન્દ્રસિંહ કાળુભાઈ ચલાવે છે.

કૃષ્ણનગર: શીલ્પાબહેન વા/ઓ પરેશભાઈ પટેલ (ઉ.વ.૩૩) (રહે. અવધ પ્રેરણા સ્કુલની બાજુમા હીરાવાડી કૃષ્ણનગર) એ અગમ્ય કારણસર તા.૧૦/૮/૧૮ રાતના ૯/૩૦ થી તા.૧૧/૮/૧૮ કલાક ૦૦/૧૫ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.જી.વહોનીયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.